

વોટ્સએપ ગ્રુપ મેમ્બર તથા એડમીન માટે મહત્વની સુચનાઓ

હાલમાં કોરોના વાયરસ(COVID-19) ની મહામારીની પરિસ્થિતિમાં અમુક લોકો સોશિયલ મીડિયાનો ખુબ દૂરુપયોગ કરતા ધ્યાને આવેલ છે. જેમા મુખ્યત્વે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટવીટર, ટીકટોક, યુટ્યુબ તેમજ સૌથી વધારે વોટ્સએપનો દૂરુપયોગ થઇ રહ્યો છે.

વોટ્સએપના માધ્યમ દ્વારા ફેક ન્યુઝ કે ખોટી અફવા તથા ઉશ્કેરણીજનક મેસેજો ફેલાવવામાં આવી રહેલ છે. આ સંજોગોમાં વોટ્સએપ ગ્રુપના મેમ્બર્સ તથા એડમીન માટે નીચે મુજબની માર્ગદર્શિકાનું યુસ્તપણે પાલન કરવાનું રહેશે.

જો તમે વોટ્સએપ ગ્રુપ મેમ્બર છો તો આટલુ ધ્યાન રાખો...

- ફેક ન્યુઝ કે ખોટી અફવા કે ઉશ્કેરણી જનક મેસેજ, પોસ્ટ, ફોટો, ઓડિયો કે વિડીયો પોસ્ટ કરવી નહિ.
- ગ્રુપના અન્ય મેમ્બર દ્વારા પોસ્ટ કરવામાં આવેલ કોઇ પણ પ્રકારની ખોટી વિગતો કે શંકાસ્પદ વિગતો ફોરવર્ડ કરવી નહિ.
- તમારા ધ્યાને આવેલ અથવા એડમીન દ્વારા સુચવવામાં આવેલ વાંધાજનક પોસ્ટ/ વિગતો તાત્કાલિક ડીલીટ કરવી.
- કોઇ પણ સમાચાર/ ઇમેજ/ વિડીયો પોસ્ટ કરતા પહેલા તેનો સ્ત્રોત તથા તેની વિગતો સાચી છે કે ખોટી તે ચકાસી લેવી.
- જો તમને કોઇ પણ જાતના ખોટી માહિતી/ વાંધાજનક પોસ્ટ/ શંકાસ્પદ વિગતો તથા ઉશ્કેરણીજનક મેસેજો જણાય તો તાત્કાલિક તમારા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો અથવા www.gujaratcybercrime.org મા જાણ કરવી તથા ગ્રુપ એડમીનને પણ જાણ કરવી.
- કોઈપણ ધર્મ / સમુદાય સામે હિંસક, અશ્લીલ અને ભેદભાવવાળી કોઈપણ પોસ્ટને ક્યારેય ફોરવર્ડ/ શેર ન કરવી.
- હાલના સમયને ધ્યાનમાં રાખી કોરોના સંબંધી કોઇ પ્રકારની ખોટી માહિતી કે ખોટી અફવા હોય તેવી પોસ્ટ ક્યારેય ફોરવર્ડ કે શેર ન કરવી. એવી કોઇ પોસ્ટ ન કરવી જેનાથી લોકોમાં ભય અને ગભરાહટ ફેલાય.

જો તમે વોટ્સએપ ગ્રુપ એડમિન છો તો આટલુ ધ્યાન રાખો...

- એડમીન તરીકે તમારા ગ્રુપના દરેક સભ્યો વિશ્વાસપાત્ર છે કે નહિ તેની ખાતરી કરી લેવી, તેમજ તેઓ દ્વારા માત્ર સાચી વિગતો ફોરવર્ડ/શેર કરવામાં આવે છે કે નહિ તેનું ધ્યાન રાખવું.
- તમામ સભ્યોને પોસ્ટ કરવાના નિયમો વિશે માહિતગાર કરવા.
- તમામ સભ્યોને વાંધાજનક સામગ્રી શેર કરવાથી રોકવા.
- ગ્રુપમાં શેર કરવામાં આવેલ પોસ્ટને નિયમિત પણે મોનિટર કરવી.
- ગ્રુપના સભ્યો તમારી સુચનાઓનું પાલન કરતા ન હોય, તો ફક્ત એડમીન પોસ્ટ કરી શકે તેવા સેટીંગ્સ રાખવા.
- જો કોઈ સભ્યો ગેરવર્તન કરે અને કોરોના સંદર્ભે વાંધાજનક/ ખોટી અફવાઓ હોય તેવી પોસ્ટ ફોરવર્ડ/ શેર કરે તો પોલીસને જાણ કરવી.

વોટ્સએપ કે અન્ય કોઈ સોશિયલ મીડિયા ઉપર વાંધાજનક/ ફેક ન્યુઝ/ ખોટી અફવા / ઉશ્કેરણીજનક/ વર્ગ વિગ્રહ થાય તેવી પોસ્ટ કરવામા આવશે તો કાયદામાં નીચે મુજબ સજાની જોગવાઈ છે :-

| | |
|--|---|
| Section 153A of IPC | જુદા જુદા જૂથો વચ્ચે ધર્મ, જાતિ, જન્મ સ્થળ, રહેઠાણ, ભાષા, વગેરેનાં આધારે હિંસાજનક પરિસ્થિતિ પેદા થાય તેવી આધરવિહીન વિગતો પોસ્ટ કરી સમાજમાં શાંતિ ડહોળવવા ના કૃત્યો કરવા બદલ દંડ સાથે ૩ થી ૫ વર્ષની કેદ. |
| Section 153B of IPC : | "વર્ગ વિગ્રહ" અને "રાષ્ટ્રીય એકતા" ના હિતો માટે રાષ્ટ્રીય એકતા ડહોળાવવા કરેલ નિવેદનો કરનાર વિરુદ્ધ સજાની જોગવાઈ. |
| Section 295A of IPC : | કોઈ પણ વર્ગની ધાર્મિક ભાવનાઓ ભડકાવવા તથા ધાર્મિક માન્યતાઓ દુભાય તેવી પોસ્ટ કરવા બદલ સજાની જોગવાઈ. |
| Section 505 of IPC : | મુજબ લોકોમાં સુલેહ – શાંતિનો ભંગ કરવાના હેતુસર ખોટા અને વાંધાજનક સમાચારો ફેલાવવા બદલ સજાની જોગવાઈ. |
| Sec 188 of the IPC : | સરકારી અધિકારી દ્વારા જાહેર કરાયેલા કોઈપણ હુકમનું અનાદર કરવા બદલ સજાની જોગવાઈ |
| Section 66C of the IT Act : | કોઈ પણ વ્યક્તિની ઓળખ ચોરી, કપટપૂર્વક અથવા બેઇમાનીપૂર્વક ઇલેક્ટ્રોનિક સહી, પાસવર્ડ અથવા અન્ય કોઈ વિશિષ્ટ ઓળખનો ઉપયોગ કરવા બદલ, ત્રણ વર્ષ સુધીની કેદ અને એક લાખ રૂપિયા સુધીનો દંડ |
| Section 54 of Disaster Management Act : | રોગચાળાની ગંભીરતા / તીવ્રતાને લગતી ભ્રામક વાંધાજનક માહિતી ફોરવર્ડ કરી ભયનો માહોલ ઉભો કરનાર વ્યક્તિ સામે એક વર્ષ સુધીની કેદ અથવા દંડની જોગવાઈ |
| Section 68 of the Gujarat Police Act, 1951 : | મુજબ તમામ વ્યક્તિઓ પોલીસ અધિકારીના સુચનોનું પાલન કરવા બંધનકર્તા રહેશે. |

- તમામ નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે એવા કોઈ પણ મેસેજ, ફોટો, ઓડિયો કે વિડીયો પોસ્ટ કરવી નહિ કે જેનાથી ધર્મ, જાતિ, ભાષા પ્રત્યે ભેદભાવ અને દુશ્મનાવટ પેદા થાય તેમજ શિષ્ટાચારનો ભંગ થાય.
- જો આવા કૃત્ય કરવામાં આવશે, તો કાયદાની જોગવાઈ મુજબ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
- કટોકટીની સ્થિતિમાં ધાર્મિક સમુદાયો વચ્ચે ગભરાટ અને અશાંતિની સ્થિતિનું નિર્માણ કરવાના હેતુથી અફવાઓ ફેલાવવામાં આવનાર વ્યક્તિઓ સામે પોલીસને કાયદેસરની કાર્યવાહી કરવાની સત્તા છે.

યાદ રાખો:

કાયદાના ઉલ્લંઘન સામે ધરપકડ સહિત કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

“દુનિયા માટે તમે એક વ્યક્તિ છો, પરંતુ પરિવાર માટે આખી દુનિયા છો.”
“લોકડાઉનનું પાલન કરો, ઘરમાં રહો, સુરક્ષિત રહો”